



કોવિડ-19 પેટ્રોન સ્ક્રિનિંગ પોસ્ટર

આ સ્થાનમાં પ્રવેશ કરતા પહેલા બધા સમર્થકોએ સ્વ-સ્ક્રીનીંગ કરવું આવશ્યક છે.

22 સપ્ટે, 2021ના રોજ અપડેટ કર્યું

1. તમને નીચેનામાંથી કોઈ નવા અથવા બગડતા લક્ષણો અથવા ચિહ્નો છે?



તાવ અથવા ઠંડી



ઉધરસ



શ્વાસ લેવામાં મુશ્કેલી



સ્વાદ અથવા ગંધમાં નુકશાન અથવા ઘટાડો



ઉબકા, ઉલટી અથવા ઝાડા (ફક્ત <18 ઉંમર માટે)



ખૂબ થાકેલા, વ્રણ સ્નાયુઓ અથવા સાંધા* (ફક્ત 18+ ઉંમર માટે)

જો તમને હાલની આરોગ્ય સ્થિતિ છે જેનાથી તમને લક્ષણો થાય છે, તો "ના" પસંદ કરો, જ્યાં સુધી લક્ષણો નવું, અલગ અથવા વધુ ખરાબ થતું ન હોય ત્યાં સુધી.

*જો કોવિડ-19 રસી મેળવ્યાના 48 કલાકની અંદર હળવો થાક, વ્રણ સ્નાયુઓ અથવા સાંધા થાય છે, તો "ના" પસંદ કરો અને તમામ જાહેર આરોગ્યના પગલાંને અનુસરવાનું ચાલુ રાખો. જો લક્ષણો 48 કલાકથી વધુ સમય સુધી ચાલે છે અથવા વધુ ખરાબ થાય છે, તો "હા" પસંદ કરો.

2. શું કોઈ ડોક્ટર છે, આરોગ્ય સંભાળ પ્રદાતા, જાહેર આરોગ્ય એકમ, અથવા કેનેડિયન બોર્ડર સર્વિસીઝ એજન્સીએ તમે કહ્યું છે કે તમારે હાલમાં અલગ રહેવું જોઈએ (ઘરે રહીને)?

હા
ના

- આ મહામારી ફાટી નીકળવાના કારણે, સંપર્ક ટ્રેસીંગ, અથવા છેલ્લા 14 દિવસમાં કેનેડાની બહાર મુસાફરી કરવાને કારણે હોઈ શકે છે.

3. તમે કોઈ એવા વ્યક્તિ સાથે રહ્યા છો જેને ડોક્ટર, આરોગ્ય સંભાળ પ્રદાતા, અથવા જાહેર આરોગ્ય એકમ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓએ હાલમાં અલગ રહેવું જોઈએ?

હા
ના

- જો તમે સંપૂર્ણપણે રસીકૃત** છો અથવા છેલ્લા 90 દિવસોમાં કોવિડ-19 માટે પરીક્ષણ હકારાત્મક આવેલ હોય અને ત્યારથી સાફ થઈ ગયું હોય તો "ના" પસંદ કરો.

જો ઉપરના કોઈપણ પ્રશ્નો માટે "હા" હોય:



આ સ્થાનમાં પ્રવેશ કરશો નહીં



ટોરોન્ટો જાહેર આરોગ્ય સલાહ અનુસરો

આરોગ્યના મુખ્ય તબીબી અધિકારીની કચેરી દ્વારા જારી ભલામણો અને સૂચનો અનુસાર વિકસિત



**સંપૂર્ણપણે રસીકૃત એટલે એક કોવિડ-19 રસી શ્રેણીની બીજા માત્રા પછી 14 દિવસો કે વધુ સમય, અથવા ઓન્ટેરિયો આરોગ્ય મંત્રાલય દ્વારા વ્યાખ્યાયિત કર્યા મુજબ.